



Ahmedabad Municipal Corporation

As per Gujarat Town Planning & Urban Development Act, 1976, Section 29(1), 34, 49(1)(B) & The Bombay Provincial Municipal Corporation Act, 1949, section 253/254

Commencement Letter (Rajachitthi)

Date: 08 FEB 2016

Case No: BLNTS/NWZ/191215/GDR/A5541/R0/M1
 Rajachitthi No: 5373/191215/A5541/R0/M1
 Arch./Engg No.: ER049507/018R2
 S.D. No.: SD0042220716R2
 C.W. No.: CW0485171220R1
 Developer Lic. No.: DEV044160120
 Owner Name: (1)VASUDEV UMEDBHAI (2)PRAVINBHAI HIRABHAI (3)PARULBEN HIRABHAI (4)GEERABEN HIRABHAI (5)NILESHBHAI HIRABHAI
 Owners Address: F/104, SUYOJAN, NR. SOLA BHAGWAT TEMPLE, SOLA Ahmedabad Ahmedabad Ahmedabad India
 Occupier Name: (1)VASUDEV UMEDBHAI (2)PRAVINBHAI HIRABHAI (3)PARULBEN HIRABHAI (4)GEERABEN HIRABHAI (5)NILESHBHAI HIRABHAI
 Occupier Address: F/104, SUYOJAN, NR. SOLA BHAGWAT TEMPLE, SOLA Ahmedabad Ahmedabad Ahmedabad Gujarat
 Election Ward: 1-GOTA
 Draft TP Scheme: 69 - Chandkheda-Jhuncal-Tragad
 Arch./Engg. Name: PAREKH SANJAY BALDEVBHAI
 S.D. Name: JOSHI KETAV P.
 C.W. Name: PARIKH DIPTI HARNISH
 Developer Name: SHAH HARESH AMRUTLAL
 Zone: New West
 Proposed Final Plot No: 263(R.S. NO.336/3)
 Block/Tenant No.: BLOCK- A B
 Plot Number: 2
 Address: SWASTIK ELEGANCE, OPP. MARUTI-7, TRAGAD, AHMEDABAD-382424.
 Height of Building: 24.55 METER

Floor Number	Usage	BuiltUp Area (In Sq mtr.)	Total Nos. of Residential Units	Total Nos. of Non Residential Units
Ground Floor	PARKING	490.32	0	0
First Floor	RESIDENTIAL	490.32	8	0
Second Floor	RESIDENTIAL	490.32	8	0
Third Floor	RESIDENTIAL	490.32	8	0
Fourth Floor	RESIDENTIAL	490.32	8	0
Fifth Floor	RESIDENTIAL	490.32	8	0
Sixth Floor	RESIDENTIAL	490.32	8	0
Seventh Floor	RESIDENTIAL	490.32	8	0
Stair Cabin	STAIR CABIN	341.43	5	0
Lift Room	LIFT	71.58	0	0
		49.38	0	0
Total		3694.69	53	0

Sub Inspector(Civic Center)

Asst. T.D.O./Asst. E.O (Civic Center)

H.R. Shah
 Dy T.D.O.
 New West

D.P. Desai
 Dy MC
 New West

Note / Conditions:

- (1) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED WITH CONDITION THAT APPLICANT AND ENGG./ARCH. WILL OBEY AS PER ALL BONDS AND WITH PROCLAMATION BY APPLICANT AND ENGG./ARCH.
- (2) IS APPROVAL IS GIVEN ACCORDING TO MUNICIPAL COMMISSIONER OFFICE ORDER DATED 02/03/05 AND OFFICE ORDER NO-42, DT-13/06/06.
- (3) THE OWNER/DEVELOPER SHALL CARRY OUT RAIN WATER HARVESTING SYSTEM AS WELL AS RAIN WATER DISPOSAL AS PER GDCR-2021 CLAUSE NO- 27.2.
- (4) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED UNDER G.D.C.R.-2021 AS PER LETTER NO: GHV/207 OF 20/14/DVP-11/2013-1777-L DATED: 20/12/2014 OF URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT, GOVT. OF GUJARAT.
- (5) RAIN WATER STORAGE TANK SHALL BE PROVIDED AS PER GDCR-2021 CLAUSE NO. 27.2.3.
- (6) THIS DEVELOPMENT PERMISSION IS GIVEN ON THE CONDITION THAT OWNER/APPLICANTS HAVE TO PROVIDE TEMPORARY RESIDENTIAL ACCOMMODATION FOR SKILLED/UNSKILLED CONSTRUCTION LABOURS IN THEIR PREMISES WITH PROPER SANITATION FACILITY. PUBLIC SPACE/ROAD WILL NOT BE ENCHROACHED FOR THE SAME IN ANY CASE AS PER OWNER/APPLICANTS SUBMIT THE NOTARISED UNDERTAKING FOR THE SAME ON DT. 12/12/2015.
- (7) THIS CASE HAS BEEN SCRUTINIZED AND APPROVED BY BUILDING PLAN SCRUTINY POOL ON DT- 19/01/2016.
- (8) THIS DEVELOPMENT PERMISSION FOR RESIDENCE BUILDING (AFFORDABLE HOUSING) IS GIVEN 25.00 MT. HEIGHT AS PER ORDER APPROVAL GIVEN BY DY. MUNI. COMMISSIONER (U.D.) DT 18/01/2016 SUBJECT TO CONDITION THAT (A) APPOINTMENT OF FIRE PROTECTION CONSULTANT BY OWNER/APPLICANT BEFORE APPLYING FOR S.U. PERMISSION AS PER NOTARISED UNDERTAKING (B) AIR PORT N.O.C. WILL BE PRODUCED BY OWNER/APPLICANT BEFORE DEVELOPMENT COMPLET 18.50 MT. HEIGHT AS NOTARISED UNDERTAKING DT-12/12/2015.
- (9) THIS PERMISSION IS SUBJECTED TO OTHER TERMS /CONDITION SPECIFIED IN BOND GIVEN BY APPLICANT FOR DEVELOPMENT DRAFT T.P. SCHEME AREA ON DATED: 24/11/2015.
- (10) THIS DEVELOPMENT PERMISSION IS GIVEN AS PER NOTARISED UNDERTAKING ON DT. 12/12/2015 FOR PARKING DEPOSIT OF HON. HIGH COURT CASE NO. C.A. (FOR STAY) NO. 1258 OF 2013 IN L.P.A. NO. 1397 OF 2013 IN S.C.A. NO. 12467 OF 2013. THE FINAL DECISION /ORDER OF HON. COURT WILL BE APPLICABLE TO OWNER/APPLICANT.
- (11) THE DEVELOPMENT PERMISSION IS GIVEN ON THE BASIS OF NOTARISED UNDERTAKING ON DT. 12/12/2015 BY OWNER/APPLICANT AND DEVELOPERS FOR THE RIGHTS TO DEVELOP AND CONSTRUCTION ON THE SAID LAND BY DEVELOPERS AND IT WILL BE BINDING AND APPLICABLE TO BOTH PARTIES.
- (12) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED SUBJECT TO RELEVANT TERMS AND CONDITIONS SPECIFIED IN OPINION GIVEN BY T.P.O. UNIT-15 AHMEDABAD DATE : 21/06/2015, REF. NO.- TPS/NO. 69/CHANDKHEDA, TRAGAD-ZUNDALUCASE NO-296/828, AND SUBJECT TO CONDITION THAT OWNER HAS TO OBEY TO THE BOND (IN CONTEXT TO T.P.O. OPINION) GIVEN BY APPLICANT.
- (13) THE ADVANCE POSSESSION OF LAND DEDUCTED FROM ORIGINAL PLOT (O.P.) FOR PUBLIC PURPOSE, ROAD AND FOR PRIVATE ALLOTMENT HAS BEEN HANDED OVER TO A.M.C. AS PER RECONSTITUTION PROPOSAL UNDER DRAFT T.P. SCHEME ACCORDING TO CIRCULAR NO. 1/07-09-2006 OF CHIEF CITY PLANNER AS PER THE NOTIFICATION OF ASSESSOR (N.W.) DTG. 08/10/2015.
- (14) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED SUBJECT TO RELEVANT TERMS AND CONDITIONS SPECIFIED IN OPINION GIVEN BY CHIEF CITY PLANNER VIDE THEIR LETTER NO- C.P.D./A.M.C./GEN/ 1302, DATED: 28/09/2015 WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANT.
- (15) ALL RELEVANT TERMS AND CONDITIONS MENTIONED IN N.A. PERMISSION GIVEN BY COLLECTOR AHMEDABAD VIDE LETTER NO- CRL AND 2/NA/SR-1762/15, DATED: 07/11/2015, WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANTS.

For Other Terms & Conditions See O-39981



આગળના પૃષ્ઠ પર કોમ્પ્યુટેન્ડ સ્ટેટિસ્ટિક્સ (રજાશ્રીકી)ની જણાવેલ શરતો ઉપરાંત નીચે જણાવ્યા મુજબની શરતોએ થી મુ. સ. પા. અને અર્બન રેવ. એક્ટ, ૧૯૭૪ની કલમ ૨૯ (૧), ૩૪, ૪૯, ૫૨ તથા ડી.બી.પી.એન.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૨૫૩ તથા ૨૫૪ ની જોગવાઈઓને આપેલ આ પરવાનગી આપવામાં આવે છે.

॥ शरदा ॥

૧. શ્રી બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯, પી.યુ. ટા. પ્લા. અને અર્બન રેવ. એક્ટ, ૧૯૭૬, ટાઉન પ્લાનિંગ એક્ટ, ૧૯૭૬, રેગ્યુલેશન, સામાન્ય વિકાસ નિયમો તેમજ પ્રવર્તમાન નીતિ- નિયમોને અનુસરીને મકાન બાંધકામ તેમજ ઉપયોગ કરવાની રહેશે. તેમજ આ અંગેના તમામ કાયદા તેમજ પેટા કાયદાનું પાલન કરવાનું રહેશે. તેમજ તેમાં જે કોઈ અંકુશ તથા શરતો મુકવામાં આવી છે તેનાથી જો નુકશાન થતું હશે તો પણ નુકશાનનો બદલો માંગ્યા સિવાય અરજદાર/માલિકે તેનો અંબલ કરવાની રહેશે.
૨. અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) આપવામાં આવ્યું હશે તો પણ પી.યુ. ટા. પ્લા. અને અર્બન રેવ. એક્ટ, ૧૯૭૬ મુજબ ટા. પ્લા. સ્કીમ અન્વયેની ડિમાન્ડ/કાગીરો તેમજ અન્ય કાયદા હેઠળ કોઈ સાર્જ ક લેવામાં બાકી હશે કે ભવિષ્યમાં ચૂકવવાના મુદ્દા તો તે મ્યુ. કોર્પોરેશન સત્તામાં જમા કરાવવાના રહેશે.
૩. અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) માં જરૂરિયા મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે. કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) માં જરૂરિયા મુજબની શરતો પૈકી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તે શરતોનો અમલ કરાવી શકશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કૃત્યને લીધે જે કોઈ નુકશાન, પોટ, કે હરકત અરજદાર/માલિકને થશે તે બદલ કોઈપણ પ્રકાર નો બદલો મળી શકશે નહીં.
૪. કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) ની તારીખથી એક વર્ષમાં બાંધકામ શરૂ કરવામાં આવેલ નહીં હોય કે નિયત સમયમર્યાદામાં પૂર્વાન રીનુઅલ અંગેની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ નહીં હોય તો કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) રાહિત આપેલ પરવાનગી આપી આપ રદ થયેલ ગણાશે.
૫. મજૂર થયેલ પ્લાન મુજબનું સ્થળ પર બાંધકામ પુરું થયેલો પી બી પી એમ.સી. એક્ટ, ૧૯૪૯ ની કલમ-૨૬૩ તેમજ સામાન્ય વિકાસ નિયમો (જી.ડી. આર.) ની જોગવાઈ મુજબ મકાન વપરાશની પરવાનગી (બી.યુ. પરમીશન) મેળવ્યા બાદ જ મજૂર કરેલ બાંધકામનો વપરાશ કરી શકાશે.
૬. પી.બી.પી. એમ.સી. એક્ટ, ૧૯૪૯ની કલમ - ૩૭૯ થી ૪૮૩માં નિર્દેશિત ક્યા પ્રમાણના પંથા અંતર ઉપયોગ માટે કોઈપણ જગ્યાનો ઉપયોગ કરતાં પહેલાં મુદ્દા, મ્યુનિ. કોર્પોરેશન/સહકા મંત્રા પાસેથી જરૂરિયાત/પરવાનગી મેળવવાના રહેશે.
૭. પ્લોટના માપો તથા લેન્ડ્રૂક મળી રહેતા હોય તે માટેની સાઈટ તરીકે પ્લોટ યોગ્ય થાય અને પ્લોટ સ્વચ્છ અને ડોળાવવાળો (બામ-પોલાણનો ભાગ રહે નહીં અને પાણી ભરાઈ રહે નહીં તેવો) થાય તો જ બાંધકામ શરૂ કરી શકાશે.
૮. GRANT OF THIS DEVELOPMENT PERMISSION SHALL NOT MEAN ACCEPTANCE OF CORRECTNESS, CONFIRMATION, APPROVAL OR ENDORSEMENT OF TITLE OF THE LAND, BUILDING, EASEMENT RIGHTS, VARIATION IN THE AREA FROM RECORDS, STRUCTURAL REPORTS & STRUCTURAL DRAWINGS, WORKMANSHIP AND SOUNDNESS OF MATERIAL USED IN CONSTRUCTION OF THE BUILDING LOCATION AND BOUNDARY OF PLOT, SOIL INVESTIGATION REPORT ETC. AND SHALL NOT BIND OR RENDER THE AUTHORITY / AMC OFFICIALS LIABLE IN ANY WAY IN THESE REGARDS (UNDER G.D.R. CL No.: 3.10)
૯. પ્લાનમાં મજૂર ક્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કર્યેથી પહેલા બીન પરવાનગીના/બિન અધિકૃત કાચા - પાકા બાંધકામ અરજદાર/માલિકે પોતાના ખર્ચ/જામને દૂર કરવાના રહેશે.
૧૦. પ્લાનમાં મજૂર ક્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કર્યેથી સામાન્ય વિકાસ નિયમો(જી.ડી. આર.) મુજબ તબક્કાવાર પ્રોગ્રેસ ચેક કરાવવાના રહેશે.
૧૧. કસમાં રજૂ કરવાના થતા સોઈલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ બ્લેન્ડ-અન્ડરટેકીંગ-બાંહેપરી વિગેરે કદન કોર્પોરેશનના રેકર્ડ હેતુ માટે હોઈ તે અંગેની જવાબદારી અ. મ્યુ. કોર્પોરેશનની તથા અધિકારી / કમચારીની રહેશે નહિ. આ અંગે જવાબદાર અરજદાર/માલિક / ડેવલપર તથા એન્જનીયર/આર્કીટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, કલાર્ક ઓફ વર્કસ રજૂ કરેલ પ્રમાણપત્ર / બાંહેપરી તથા રીપોર્ટને આધારેનું સાબી જવાબદારી તમામની (અરજદાર/માલિક / ડેવલપર તથા એન્જનીયર / આર્કીટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, કલાર્ક ઓફ વર્કસ) રહેશે.
૧૨. બીલીંગ મટરીયલ કે કાટમાળ મ્યુ. રસ્તા ઉપર કે કુટપાથ ઉપર નાંખવામાં આવશે તો તેના કારણે રસ્તા કે કુટપાથને જે કોઈ નુકશાન થશે તેનું ખર્ચ વત્તા નિયમાનુસારની પેનલ્ટીની રકમ અરજદાર/માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. તેમજ આ બાંધકામની કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજીસ્ટ્રી) રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
૧૩. સામાન્ય વિકાસ નિયમો(જી.ડી. આર.) ની જોગવાઈ તેમજ જે તે સમયે સરકારથી દારા જાહેર કરાયેલ નીતિ અનુસાર પરકોલેઈંગલેવેલ/ પીટ, વોટર હાઈડ્રોલોજી, ડ્રી-પ્લાન્ટેશન/વૃક્ષારોપણની જોગવાઈ બીલીંગ પ્લોટમાં કરવાની રહેશે. સોર્ટીંગ ટેન્ક તથા સોલવેબની સાઇઝ તથા સંખ્યા, ઈન્સ્પેક્શન ચેમ્બર, મેનહોલ વિગેરે ડ્રેનેજ લેઆઉટમાં જતાવ્યા મુજબના સ્થળે કરવાની જવાબદારી અરજદાર/માલિક/ડેવલપર તથા એન્જનીયર/આર્કીટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જનીયર, કલાર્ક ઓફ વર્કસની રહેશે.
૧૪. મકાનમાં બાંધકામ/કિમોલીશ કરતી વખતે અથવા ત્યારબાદ આજુબાજુના મકાનો/ગિલ્લતને અન્ય કોઈપણ જાતનું નુકશાન કે જાનમાન્ય થશે તો તેને સંપૂર્ણ જવાબદારી અરજદાર/માલિક / ડેવલપર તથા એન્જનીયર/ આર્કીટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જનીયર, કલાર્ક ઓફ વર્કસની રહેશે. અ. મ્યુ. કોર્પોરેશન આ બાબતે દિવાની ચા કોજારી રાહે જવાબદાર ગણાશે નહિ. તેમજ આજુબાજુના સ્થીશોને કોઈપણ સમયે ખેલવું / નુકશાન થાય નહિ તે રીતે બાંધકામ / કિમોલિશનાની કામગીરી કરવાની રહેશે.
૧૫. મજૂર થયેલા પ્લાન તેમજ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજીસ્ટ્રી) ની નકલ દરેક મેમ્બરને કરજણવત આપવાની રહેશે અને બાંધકામને સોર્ટીંગ પર નોટિસ બોર્ડ ઉપર જોડવામાં જોઈ શકાય તે રીતે દર્શાવવાની રહેશે.
૧૬. મકાન વપરાશની પરવાનગી (બી.યુ. પરમીશન) મેળવ્યા બાદ જ ડ્રેનેજ / પાણી તથા અન્ય સર્વિસ-પુટીલીટી માટે ગિલ્લાનુસાર અરજ કરી શકાશે.
૧૭. બાંધકામ તથા અન્ય બાબતો સામાન્ય વિકાસ નિયમો(જી.ડી. આર.) ક્રાસ સુસંગત નહીં હોય કે સામાન્ય વિકાસ નિયમો(જી.ડી. આર.)ના વિનિયમ ૩.૬ મુજબ અરજદાર માલિકે પોટી રજીસ્ટ્રાર અથવા ખાલે હસ્તાવજ પુરાવા રજૂ કરેલ હશે તો આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ(રજીસ્ટ્રી) તથા મજૂર કરેલ પ્લાન આપો આપ રદ થયેલ ગણાશે.
૧૮. સોલર હેડ અથવા અન્ડરગ્રાઉન્ડ પાણીની લોંકી હવા ચુસ્ત લોકાણી બંધ રાખવી. મટરની વેન્ટ પાઇપ ઉપર ઝીંખું ફપડું બાંધીને રાખવું અથવા પાતળા વામરની જાગી રાખવી. પેલેટીયા કમચારી માટે ઓવરહેડ ટાંકીની તપાસ માટે સીડીની ભવર્યા કરવી.
૧૯. કન્સ્ટ્રક્શન / કિમોલીશની પ્રવૃત્તિ દરમ્યાન પ્લોટની રસ્તા તરફની બાજુએ ઓછામાં ઓછી ૩ મી. ઊંચાઈની પેટરની વાડ (બેરીકેડ) સ્થાપિતના હેતુસર કરવાની રહેશે.
૨૦. RESPONSIBILITY (G.O.R. 4.3 & 4.4) : APPROVAL OF DRAWINGS AND ACCEPTANCE OF ANY STATEMENT, DOCUMENTS, STRUCTURAL REPORT, STRUCTURAL DRAWINGS, PROGRESS CERTIFICATE OR BUILDING COMPLETION CERTIFICATES SHALL NOT DISCHARGE THE OWNER, ENGINEER, ARCHITECT, CLERS OF WORKS/SITE SUPERVISOR, STRUCTURAL DESIGNER, DEVELOPER, OWNER FROM THEIR RESPONSIBILITIES, IMPOSED UNDER THE ACT, THE DEVELOPMENT REGULATIONS AND THE LAWS OF TOWN AND LOCAL ACTS.
૨૧. LIABILITY (G.O.R. 4.3.1) : NOTWITHSTANDING ANY DEVELOPMENT PERMISSION GRANTED UNDER THE ACT AND THESE REGULATIONS, ANY PERSON UNDERTAKING ANY DEVELOPMENT WORK SHALL CONTINUE TO BE WHOLLY AND SOLELY LIABLE FOR ANY INJURY OR DAMAGE OR LOSS WHATSOEVER THAT MAY BE CAUSED TO ANY ONE IN OR AROUND THE AREA DURING SUCH CONSTRUCTION AND NO LIABILITY WHATSOEVER IN THIS REGARD SHALL BE CAST ON THE AUTHORITY OR ANY OFFICER.
૨૨. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પત્ર ક્રમાંક નં. પરચ/૮૦૨૮૧/૦/૬૩૨૨ પૃષ્ઠી તા. ૧૬-૧૧-૨૦ ના પત્ર અનુસાર બાંધકામની જગ્યાએ મોટા અથવા જણરાતી ભાષામાં બાંધકામની તમામ વિગતો દર્શાવતું બોર્ડ કાપતી મુકવાની શરત.

ઉપર જણાવેલ કોઈપણ શરતીનો ભંગ થશે તો આપેલ બીજામંત્ર આરંભ અમાણપત્ર (રજીસ્ટ્રી) રદ કરવામાં આવશે.

३५. अभिधान-रसः

આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજા યોડી) દ્વારા જે વિકાસ કરવા પરવાનગી અપાયે છે તે અમે વિકાસ પરવાનગી મેળવવા જે પ્લાન સાથે અરજી તેમજ બાઈબીડી, રજા યોડી તથા કમ્પાઈન્ટ, મોડે અરજીઓ કે પ્લાનમાં અમલ દ્વારા કરવાનો આવેલ રજૂઆત સામગ્રી વિકાસ નિયમો(જી. ડી. આર. ની) નિયમો સામે રજૂ કરે તે નહીં તો તેમજ બાઈબીડી કે અરજીઓ અમલ દ્વારા કરવામાં આવેલ રજૂઆત નોટીફીકેશન દ્વારા આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજા યોડી) રદ થયેલી રજૂઆત તથા કમ્પાઈન્ટ નોંધકામ અમલ અને જોખમ અમલદારનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરી શકાય અને કમ્પાઈન્ટ દ્વારા કરવા અને કાયદાકીય કાર્યક્રમ પ્રકારની નોટિસ કે જણાવ કરવાની રહેશે નહીં. આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજા યોડી) ની ઉપરોક્ત તમામ શરતો મુજબમો ચાલે છે અને તે સાથે અમે સોમટરીએલ

भा.वि.३ / अ.३०८.३-५/२५६

Sanjay B. Parekh

A.M.D. LIC. No. EPD495074628-2, and
301, 3rd Floor, Aagam Complex,
Mithakhali, Ahmedabad - 61.